

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી



Accredited Grade A by NAAC

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલય ,
યુનિવર્સિટી કેમ્પસ , યુનિવર્સિટી રોડ,
રાજકોટ - ૩૬૦૦૦૫
ફોન નં. ૨૫૭૮૫૦૧ થી ૧૨



નં.જોડાણ/૯/૫૨૮/૨૦૧૮

ત્તા.૧૪/૦૬/૨૦૧૮

વિષય : તા.૧૧/૦૬/૨૦૧૮ ના રોજ મળેલ આચાર્યશ્રીઓની બેઠકમાં થયેલ ચર્ચાની અમલવારી બાબત

પરીપત્ર :

આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે તા.૧૧/૦૬/૨૦૧૮ ના રોજ યુનિવર્સિટી ખાતે મળેલ આચાર્યશ્રીઓની બેઠકમાં થયેલ ચર્ચા પરત્વે નીચે મુજબની વિગતે અમલવારી કરવાની થાય છે તથા થયેલ કામગીરીનો અહેવાલ અત્રેની યુનિવર્સિટીને મોકલવા વિનંતી છે.

- ૧) એકેડેમિક કેલેન્ડરની રચના બાબત
 - અત્રેની યુનિવર્સિટીના તા.૧૧/૦૬/૨૦૧૮ ના પરીપત્ર નં.એકે./ઓ-૯૫/ઓ-૨૦૫/૪૭૮/૨૦૧૮ થી શૈક્ષણિક સત્ર વ્યવસ્થા ૨૦૧૮-૧૯ નો પરિપત્ર કરવામાં આવેલ છે, જે મુજબ અમલ થવા વિનંતી.
- ૨) વર્ષ ૨૦૧૮-૧૯, પ્રવેશ ઇન્ટેક બાબત
 - અત્રેની યુનિવર્સિટીના તા.૦૯/૦૫/૨૦૧૮ ના પરિપત્ર નં.જોડાણ/૯/૨૯૫/૨૦૧૮ થી સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં પ્રવેશ ઇન્ટેક નિયત કરવામાં આવેલ છે.
 - સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં સરકાર માન્ય ડીવીઝન/બેચ મુજબ જ પ્રવેશ આપવાનો રહે છે. જો સંસ્થા પાસે પુરતી માળખાકીય સુવિધા, સ્ટાફ હશે તો મંજૂર થયેલ ડીવીઝન/બેચ માં સંખ્યા વધારા માટે યુનિવર્સિટી વિચારણા કરશે. આ માટે માળખાકીય સુવિધાઓ, સ્ટાફ વગેરેના જસ્ટિફિકેશન સાથે સંસ્થાએ યુનિવર્સિટીને દરખાસ્ત કરવાની રહેશે.
- ૩) વિશ્વ યોગ દિવસ તા.૨૧/૦૬/૨૦૧૮ ના આયોજન બાબત
 - તા.૨૧/૦૬/૨૦૧૮ ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાની થાય છે. ગત વર્ષોમાં જે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ તે જ રીતે ચાલુ વર્ષમાં પણ આયોજન કરવાનું થાય છે.
 - યોગ દિવસની ઉજવણી કોલેજના કમ્પાઉન્ડ ખાતે અથવા સંસ્થાને અનુકૂળ રહે તે જાહેર જગ્યાએ સ્વતંત્ર રીતે અથવા સમૂહમાં કરી શકે છે.
 - રાજકોટ શહેરની જે સંસ્થાઓ યુનિવર્સિટી કેમ્પસ પર ભાગ લેવા ઇચ્છે છે, તેવી સંસ્થાઓએ નીચે મુજબના અધિકારીશ્રીઓનો સંપર્ક કરવાનો રહેશે.

| | |
|-------------------------------|--------------------------------|
| ૧) પ્રિ. ડો. વિજયભાઈ પટેલ | સરકારી - ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો |
| ૨) પ્રિ. ડો. રાજેશભાઈ કાલરીયા | સરકારી - ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો |
| ૩) શ્રી શૈલેષભાઈ જાની | સ્વનિર્ભર કોલેજો |
| ૪) શ્રી સર્વેશ્વરભાઈ ચૌહાણ | સ્વનિર્ભર કોલેજો |
 - સ્વનિર્ભર કોલેજોના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ, સ્ટાફ યુનિવર્સિટી ખાતે યોગા ડે ની ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે ડો. મેહુલભાઈ રૂપાણી તથા ડો. ધરમભાઈ કાંબલીયાએ ઉપર્યુક્ત અધિકારીશ્રીઓને સહાયરૂપ થવા વિનંતી છે.
 - જે વિદ્યાર્થીઓ યોગા ડે નિમિત્તે યુનિવર્સિટી કેમ્પસ પર હાજરી આપશે, તેને યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
 - અત્રેની યુનિવર્સિટીના નીચે મુજબના પરિપત્રો યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જે મુજબ કાર્યવાહી કરી તેનો વિગતવાર અહેવાલ મોકલી આપવાનો રહેશે.

૧) નં.શા.શિ./આ.યો.દિ.ઉ./૦૪/૨૦૧૮ તા.૧૯/૦૪/૨૦૧૮

૨) નં.શા.શિ.ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા/૧૪/૨૦૧૮ તા.૧૨/૦૬/૨૦૧૮

૪) મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની અમલવારી બાબત

- રાજ્યમાં આવેલ વિવિધ સંસ્થાઓ/એકમોના વિવિધ વ્યવસાયોમાં તેમની માંગણી મુજબ તાલીમ પામેલ ઉમેદવારો મળી રહે તેમજ રાજ્યના યુવાનોને રોજગારલક્ષી તાલીમ/કૌશલ્ય પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્ય સરકારશ્રીએ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અમલમાં મુકેલ છે.
- યોજના મુજબ સંસ્થા ખાતે ભરવાપાત્ર થાય તેવી જગ્યાઓની યાદી અત્રેની યુનિવર્સિટીને મોકલી આપવાની રહેશે.

- સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

- સંસ્થા ખાતેથી છેલ્લા ૩ વર્ષમાં બહાર પડેલ વિદ્યાર્થીઓનું ઉમેદવાર તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

- યોજનાની વધુ વિગતો આ સાથે સામેલ છે.

- વધુ વિગતો માટે નીચે મુજબના અધિકારીશ્રીઓનો સંપર્ક સાધવાનો રહેશે.

૧) શ્રી જય ચાવડા - પ્લેસમેન્ટ ઓફિસર - ઓફીસ - ૦૨૮૧ ૨૫૭૮૫૦૧, એકસ્ટે. ૩૨૦

૨) શ્રી મુકેશભાઈ મુંજાણી - એપ્રેન્ટીસશીપ એડવાઈઝર - મો.નં. ૯૪૨૬૯ ૫૦૪૯૬

૩) શ્રી એ.બી. પટેલ - એપ્રેન્ટીસશીપ એડવાઈઝર - મો.નં. ૯૪૨૬૦ ૪૭૦૨૪

૪) શ્રી રાજેશભાઈ ત્રિવેદી - આચાર્યશ્રી, આઈ.ટી.આઈ., રાજકોટ - મો.નં. ૯૪૨૭૨ ૧૩૪૫૨

- દરેક સંસ્થાએ આ સાથે સામેલ પત્રક - A,B,C ભરીને ઈ-મેઈલ આઈ.ડી. maysurajkot@gmail.com પર માહિતી મોકલી આપવાની રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સદરહુ યોજનાની સંકલન કામગીરી માટે નીચે મુજબના અધિકારીશ્રીઓની નિયુક્તિ કરેલ છે, જેનો પણ સંપર્ક સાધી શકાશે.

| ક્રમ | નામ અને હોદ્દો | કાર્યક્ષેત્ર | મો.નંબર |
|------|---|-----------------------------------|------------|
| ૧ | ડો. રમેશભાઈ પરમાર, નાયબ કુલસચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી | સમગ્ર બાબતોના કોઓર્ડિનેટર | 9099912015 |
| ૨ | ડો. મેહુલભાઈ રૂપાણી, સિન્ડિકેટ સભ્યશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી | સંલગ્ન સ્વનિર્ભર કોલેજો | 9824497497 |
| ૩ | ડો. રાજેશભાઈ કાલરીયા, આચાર્યશ્રી, કણસાગરા કોલેજ, રાજકોટ | સંલગ્ન સરકારી/બિનસરકારી કોલેજો | 9099040404 |

બિડાણ :

૧) પત્રક - A, B, C નો નમુનો

૨) એપ્રેન્ટીસશીપ યોજનાની વિગત

પ્રતિ,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ

નકલ સાદર રવાના :

૧) માનનીય કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી

૨) કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર

૩) નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગર

આપનો વિશ્વાસુ

કુલસચિવ

14/6

નકલ રવાના જાણ અર્થે :

- ૧) ડો. જયંત ચાવડા, આચાર્યશ્રી, બી.કે. મોદી ફાર્મસી કોલેજ, રાજકોટ
- ૨) આચાર્યશ્રી, આઈ.ટી.આઈ., આજીડેમ, રાજકોટ
- ૩) પ્રિ.ડો. વિજયભાઈ પટેલ, સીન્ડીકેટ સભ્યશ્રી
- ૪) ડો. મેહુલભાઈ રૂપાણી, સીન્ડીકેટ સભ્યશ્રી
- ૫) ડો. ધરમભાઈ કાંબલિયા, સીન્ડીકેટ સભ્યશ્રી
- ૬) શ્રી શૈલેશભાઈ જાની, ગીતાંજલી કોલેજ, રાજકોટ
- ૭) શ્રી સર્વેશ્વરભાઈ ચૌહાણ, હરિવંદના કોલેજ, રાજકોટ
- ૮) પ્રો. હિતેશભાઈ શુક્લા, એમ.બી.એ. ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
- ૯) પ્રો. મિહિરભાઈ રાવલ, ફાર્મસી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
- ૧૦) પ્લેસમેન્ટ ઓફિસરશ્રી, પ્લેસમેન્ટ સેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
- ૧૧) નિયામકશ્રી, કોમ્પ્યુટર સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (વેબ સાઈટ પર પ્રસિદ્ધિ અર્થે)

❖ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના:

મુખ્ય ઉદ્દેશ્ય:

- રાજ્યમાં આવેલ વિવિધ સંસ્થાઓ/એકમોના વિવિધ વ્યવસાયોમાં સંસ્થાઓ/એકમોની માંગ અનુસાર યુવાનોને તાલિમ આપી કૌશલ્ય કુશળ બનાવી રોજગારીની તકોમાં વધારો.

યોજનાની અમલવારી:

- એપ્રેન્ટીસ અધિનિયમ (સુધારા) ૨૦૧૪ અને એપ્રેન્ટીસ અધિનિયમ (સુધારા) ૨૦૧૫ સાથે એપ્રેન્ટીસ તાલિમ યોજનાના વ્યાપને વિસ્તારવા અને સન ૨૦૨૦ સુધીમાં ૫૦ લાખ એપ્રેન્ટીસની ભરતી કરવાના લક્ષ્યાંક સાથે નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કીમ (NAPS) શરૂ કરવામાં આવી છે.
- ભારત સરકારશ્રી ના તારીખ ૧૯/૦૮/૨૦૧૬ ના નોટીફિકેશન મુજબ અમલ શરૂ.
- એપ્રેન્ટીસ અધિનિયમની જોગવાઈ મુજબ ૪૦ કે તેથી વધુ માનવબળ (Regular + Contractual) ધરાવતી સંસ્થાઓએ કુલ માનવબળની સંખ્યાના ૨.૫ થી ૧૦% ની મર્યાદામાં એપ્રેન્ટીસ ભરતી કરવી ફરજિયાત છે.
- તે અનુસાર રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં ઉત્તિર્ણ થયેલ સ્નાતક, ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી નીચેની પદવી ધરાવનાર ઉમેદવારોને એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ આવરી લઈ પ્રત્યેકને લઘુત્તમ રૂપિયા ૬૦૦૦/- નું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે.

ઉમેદવારની લાયકાત:

- વય મર્યાદા (સ્ત્રી/પુરુષ): ૧૪ વર્ષથી ઉપર.
- જોખમી પ્રકારના ઉદ્યોગો: ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ.

ઉમેદવારની શૈક્ષણિક લાયકાત:

- ધોરણ ૮ ઉત્તિર્ણથી સ્નાતક કક્ષા સુધીના કોઈપણ ઉમેદવાર.
- વર્ષ ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ માં સરકારમાન્ય અભ્યાસક્રમમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવાર.

Stipend Details

Stipend : Rs. 6000/- per month (1 year) Amount in Rs.

| Apprentice Type | GoI Share | GoG Share | Establishment Share | Total |
|--------------------|-----------|-----------|---------------------|-------|
| Graduate | 1500 | 3000 | 1500 | 6000 |
| Diploma | 1500 | 2000 | 2500 | 6000 |
| Lower than Diploma | 1500 | 1500 | 3000 | 6000 |

સરકારશ્રી દ્વારા લાભાર્થી યુવાનોના અપ્રેન્ટિસ સ્ટાઈપેન્ડ માં સરકારનું યોગદાન હોય છે.

એપ્રેન્ટિસને મળવા પાત્ર વૃત્તિકા (સ્ટાઈપેન્ડ):-

- એપ્રેન્ટિસ પાસેથી કોઈ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી.
- તાલીમની સાથો સાથ એપ્રેન્ટિસોને એકમ ધ્વારા હાલના પ્રવર્તમાન નિયમો મુજબ નીચે મુજબની લઘુત્તમ વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) તરીકે આપવામાં આવે છે. અર્ધ કુશળ કારીગરોને આપવામાં આવતા લઘુત્તમ વેતન દરના:- પ્રથમ વર્ષ - ૭૦ ટકા; બીજું વર્ષ - ૮૦ ટકા અને તૃતીય વર્ષ - ૯૦ ટકા
- આમ છતાં એકમ સ્વેચ્છાએ ઉપરોક્ત રકમ કરતા પણ વધુ રકમની વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) આપી શકે છે.

પરિક્ષા પ્રમાણપત્ર :-

- તાલીમનો નિયત સમય પૂર્ણ થયા બાદ વ્યવસાયિક ધંધાની તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સિલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબર અંતિત અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજાવામાં આવે છે.
- સફળ થયેલા એપ્રેન્ટિસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી.વિગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે.

એપ્રેન્ટીસ ભરતી માટેની શરતો (સંસ્થાઓ/એકમો માટે):

- Regular + Contractual માનવબળ: ૧ - ૬ : ભરતી ન કરી શકે (Can't Enroll)
- Regular + Contractual માનવબળ: ૭ - ૩૯ : ભરતી કરી શકે (Can Enroll)
: કુલ માનવબળના ૨.૫ થી ૧૦%
- Regular + Contractual માનવબળ: ૪૦ કે તેથી વધુ : ભરતી ફરજિયાત (Mandatory)
: કુલ માનવબળના ૨.૫ થી ૧૦%

એપ્રેન્ટીસ તરીકે ભરતી થવા માટેની શરતો (ઉમેદવારો માટે):

- એપ્રેન્ટીસ તરીકે તાલિમ લીધેલ ન હોવી જોઈએ.
- કામ કરવાનો અનુભવ ૧ વર્ષથી વધુ ન હોવો જોઈએ.
- લાયકાતની પરીક્ષા પાસ કર્યા બાદનો સમયગાળો ૩ વર્ષ થી ઓછો હોવો જોઈએ.

સંસ્થાઓ/એકમો માટે ફરજિયાત નોંધણી:

કંપની/ઉદ્યોગ/એપ્રેન્ટીસ આપનાર એકમએ નીચેની લિન્કમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

આપના એકમમાં જો તકનીકી ઉમેદવારની જરૂર હોય તો www.mhrdnats.gov.in લિંક પર નોંધણી કરાવવી ફરજિયાત છે.

જો તમને બિન-તકનીકી ઉમેદવારની જરૂર હોય તો www.apprenticeship.gov.in પર નોંધણી કરાવવી ફરજિયાત છે.



ખાસ નોંધ (સંસ્થાઓ/એકમો માટે):

- દરેક સંસ્થાઓ/એકમો એ ઉપર સુચવેલ પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ <http://matsgujarat.org> પર નોંધણી કરાવવી ફરજિયાત છે.

ઉમેદવારો માટે ફરજિયાત નોંધણી:

વિદ્યાર્થીઓએ નીચેની લિન્કમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

જો તકનીકી વિદ્યાર્થી હોય તો www.mhrdnats.gov.in લિંક પર નોંધણી કરાવવી ફરજિયાત છે.



જો બિન-તકનીકી વિદ્યાર્થી હોય તો www.apprenticeship.gov.in પર નોંધણી કરાવવી ફરજિયાત છે.



ખાસ નોંધ (ઉમેદવારો માટે):

- દરેક ઉમેદવારોએ ઉપર સુચવેલ પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ <http://matsgujarat.org> પર નોંધણી કરાવવી ફરજિયાત છે.

આવશ્યક દસ્તાવેજો (સંસ્થાઓ/એકમો માટે):

- Certificate of Incorporation
- PAN/TAN Number
- Immediate past assessment year income tax return
- Total manpower details
- Details on internal complaint committee on sexual harassment of women at work place
- Structured training module for a year
- Brief profile about the establishment (type: PDF, size: less than 1MB)
- Mobile number (OTP will be sent to this number)

આવશ્યક દસ્તાવેજો (ઉમેદવારો માટે):

- Aadhaar Card
- Valid Personal Email Id
- Mobile number (will be required to send/verify OTP)
- Passport size photograph (Format: JPEG, Size: Less than 200kb)
- Bank account details: Bank Name, IFSC Code, Account Number, Branch
- Qualifying Degree / Provisional Certificate (Format: PDF, Size: Less than 1mb)

નોંધ:

- એપ્રેન્ટીસ એ કોઈ કર્મચારી નથી, તાલિમાર્થી છે.
- કોઈપણ પ્રકારની કાયદાકીય જવાબદારી નથી.
- સમય મર્યાદા: ૧ વર્ષ
- રોજગારી સર્જવામાં, માનવબળને તાલીમ આપવામાં સહયોગ આપવો.
- એપ્રેન્ટીસ, સંસ્થા, સરકાર માટે Win-Win Situation.
- માન્ય ટ્રેડનું લિસ્ટ સાથે જોડેલ છે.

475 A

College/Institute Name: _____

College Code: _____

Contact Person: _____

Designation: _____

Email Id: _____

WhatsApp Number: _____

Total Number of Employees (Regular + Contractual): _____

Total Number of Apprentice Required in Your Organization: _____

Establishment Registration Number given by Apprenticeship Website: _____

Registration Number given by MATS Website: _____

(Note: All details are mandatory)

પત્રક B

Institute Name:

Institute Contact Number:

Establishment Number:

| ક્રમ | એપ્રેન્ટીસ નો પ્રકાર (લેબ આસિસ્ટન્ટ, ડેટા એટ્રી ઓપરેટર, આસિસ્ટન્ટ, સિક્યુરિટી ગાર્ડ વગેરે) | ભરતી થયેલ એપ્રેન્ટીસ નું નામ | ભરતી થયેલ એપ્રેન્ટીસ નો મોબાઇલ નંબર | ભરતી થયેલ એપ્રેન્ટીસ નો નોંધણી નંબર | ભરતી થયેલ એપ્રેન્ટીસ ની લાયકાત |
|------|--|------------------------------------|---|---|--------------------------------------|
| ૧ | | | | | |
| ૨ | | | | | |
| ૩ | | | | | |
| *** | | | | | |
| *** | | | | | |

| | | | | | | |
|-----|--|--|--|--|--|--|
| કુલ | | | | | | |
|-----|--|--|--|--|--|--|

(*** જે તે સંસ્થા ની એપ્રેન્ટીસ ભરવાની થતી સંખ્યા મુજબ)

પત્રક C

છેલ્લા ૩ વર્ષના જે તે સંસ્થાના ઉમેદવારોની નોંધણીની માહિતી

Institute Name:

Institute Contact Number:

Establishment Number:

| ક્રમ | ઉમેદવારનું નામ | apprenticeship. gov.in પરથી મેળવેલ નોંધણી નંબર | matsgujar at.org પરથી મેળવેલ નોંધણી નંબર | મેળવેલ ડિગ્રી | ડિગ્રી નું વર્ષ |
|------|-------------------|--|---|------------------|--------------------|
| ૧ | | | | | |
| ૨ | | | | | |
| ૩ | | | | | |
| *** | | | | | |

(*** જે તે સંસ્થા ની એપ્રેન્ટીસ ભરવાની થતી સંખ્યા મુજબ)